https://archive.org/details/bk839/page/n0/mode/1up

2016-06-07 -List of Trustees of Pirana (839)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

T. No. : (૦૨૭૧૮) ૨૮૮૨૨૭ ચેરમેન
(૦૨૭૧૮) ૨૮૮૨૨૯ ઓફીસ
(૦૨૭૧૮) ૨૮૮૨૭૨ ફેક્સ

The Imamshah Bava Roza Sanstha Committee

At & Post : Pirana, Ta. Dascroi, Dist. Ahmedabad. • Trust Reg. No. E 738

ધી ઈમામશાહ બાવા રોજા સંસ્થા કમિટિ

Full Library on https://realpatidar.com/library

...ચેરીટેબલ ટ્રસ્ટ રજી.નં. ઈ. ૭૩૮
...તિથી - આચાર્ય નાનજીકાકા ગુરૂ કરશનકાકા

મુ.પો. પીરાણા, તા. દશક્રોઈ, વાયા બારેજા
જી. અમદાવાદ. પીન કોડ - ૩૮૨૪૨૫.

વિજેતા ઉમેદવારોની યાદી

તારીખ : ૭/૬/૨૦૧૬

[illegible]

ક્રમ	સતપંથી	પરિણામ
૧	માનકુંવા વિભાગ (કોટડા) – પટેલ અંબાલાલ દેવરામભાઈ ભોજાણી	બિન હરીફ
૨	વિથોણ વિભાગ (દેવપર) – પટેલ હિરાલાલ વેલજીભાઈ	બિન હરીફ
૩	નેત્રા વિભાગ (નેત્રા ઘડાણી) - પટેલ પરસોતમભાઈ ખેતાભાઈ લીંબાણી	બિન હરીફ
૪	કપડવંજ વિભાગ (વજેપુરા) – પટેલ ખીમજીભાઈ સવદાસભાઈ	બિન હરીફ
૫	ભાવનગર વિભાગ (ભાવનગર) – અંધારીયા આશિષભાઈ રસિકલાલ	બિન હરીફ
૬	ચરોતર વિભાગ (ગોઠાજ લાટ) – પટેલ અરવિંદભાઈ મગનભાઈ	બિન હરીફ
૭	સુરત-કાનમ વિભાગ (અઠવા) - પટેલ જયેશભાઈ જેરામભાઈ	બિન હરીફ

ક્રમ	સાદાત (સૈયદ)	
૧	પીરાણા વિભાગ – સૈયદ ઝૈનુલઆબેદીન રીયાઝહુસેન	ચુંટણીમાં વિજેતા
૨	કાનમ વિભાગ – સૈયદ આસિફહુસેન રફીમીયાં	ચુંટણીમાં વિજેતા
૩	પેટલાદ વિભાગ – સૈયદ નદીમ અહેમદ શફીમિયાં	બિન હરીફ

ચૂંટણી [illegible]રીશ્રી
ધી ઈમામશાહ બાવા રોજા સંસ્થાન
પ્રેરણા પીઠ, પીરાણા

realpatidar.com

https://archive.org/details/bk839/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk839/page/n2/mode/1up

T. No. : (૦૨૭૧૮) ૨૮૮૨૨૭ ચેરમેન
(૦૨૭૧૮) ૨૮૮૨૨૯ ઓફીસ
(૦૨૭૧૮) ૨૮૮૨૦૨ ફેક્સ

realpatidar.com

The Imamshah Bava Roza Sanstha Committee

At & Post : Pirana, Ta. Dascroi, Dist. Ahmedabad. • Trust Reg. No. E 738

ધી ઈમામશાહ બાવા રોજા સંસ્થા કમિટિ

પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ રજી.નં. ઈ. ૭૩૮
ગાદીપતિશ્રી - આચાર્ય નાનજીકાકા ગુરૂ કરસનકાકા
મુ.પો. પીરાણા, તા. દશક્રોઈ, વાયા બારેજા
જી. અમદાવાદ. પીન કોડ - ૩૮૨૪૨૫.

રેફ નં. :

વિજેતા ઉમેદવારોની યાદી

તારીખ : ૭/૬/૨૦૧૬

ક્રમ	સતપંથી	પરિણામ
૧	માનકુંવા વિભાગ (કોટડા) – પટેલ અંબાલાલ દેવરામભાઈ ભોજાણી	બિન હરીફ
૨	વિથોણ વિભાગ (દેવપર) – પટેલ હિરાલાલ વેલજીભાઈ	બિન હરીફ
૩	નેત્રા વિભાગ (નેત્રા ઘડાણી) - પટેલ પરસોતમભાઈ ખેતાભાઈ લીંબાણી	બિન હરીફ
૪	કપડવંજ વિભાગ (વજેપુરા) – પટેલ ખીમજીભાઈ સવદાસભાઈ	બિન હરીફ
૫	ભાવનગર વિભાગ (ભાવનગર) – અંધારીયા આશિષભાઈ રસિકલાલ	બિન હરીફ
૬	ચરોતર વિભાગ (ગોઠાજ લાટ) – પટેલ અરવિંદભાઈ મગનભાઈ	બિન હરીફ
૭	સુરત-કાનમ વિભાગ (અઠવા) - પટેલ જયેશભાઈ જેરામભાઈ	બિન હરીફ

ક્રમ	સાદાત (સૈયદ)	
૧	પીરાણા વિભાગ – સૈયદ ઝૈનુલઆબેદીન રીયાઝહુસેન	ચુંટણીમાં વિજેતા
૨	કાનમ વિભાગ – સૈયદ આસિફહુસેન રફીમીયાં	ચુંટણીમાં વિજેતા
૩	પેટલાદ વિભાગ – સૈયદ નદીમ અહેમદ શફીમિયાં	બિન હરીફ

ચૂંટણી અધિકારીશ્રી
ધી ઈમામશાહ બાવા રોજા સંસ્થાન
પ્રેરણા પીઠ, પીરાણા

realpatidar.com